

RIDDHI CORPORATE SERVICES LIMITED

ISO 9001:2015, 27001:2013 & CMMI Level 3 Certified Company

CIN: L74140GJ2010PLC62548

DATE: - 02nd June, 2023

TO,
THE SECRETARY,
BOMBAY STOCK EXCHANGE LTD.,
25TH FLOOR,
PHIRBZE JEEJEEBHOY TOWERS,
DALAL STREET, MUMBAI -400 001,

BSE SCRIP CODE: - 540590 SYMBOL: RIDDHI CORP ISIN: INE325X01015

Dear Sir,

Sub: -Submission of newspaper advertisement as per Regulation 47 of SEBI (Listing obligation and Disclosure Requirements) Regulations, 2015.

Pursuant to the provisions of Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we are enclosing herewith the copies of Publication of the audited Financial Results in the Jai Hind (Gujarati News Paper and Ahmedabad Edition) and in Business Standard (English News Paper and Ahmedabad Edition) regarding the audited Financial Results of the company approved in the Board Meeting held on 30th May, 2023 for the Quarter & Year ended on 31th March, 2023.

Kindly take the above information on your records.

Thanking you.
Yours Faithfully
For, Riddhi Corporate Services Limited

MUSTAFA M. SIBATRA
Company Secretary & Compliance Officer

Encl: As above

- 1. Paper of Business Standard (Extract) English
- 2. Paper of Jai Hind (Extract) Gujarati

POSSESSION NOTICE (FOR IMMOVABLE PROPERTY)

(As per Appendix IV read with rule 8(1) of the Security Interest Enforcement Rules, 2002) Whereas, the undersigned being the Authorized Officer of the Hero Housing Finance Limited, under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Ac 2002 and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002, issued a demand notices as mentioned below calling upon the Borrowers to repay the amount mentioned in the notice within 60 days from the date of the said notice The borrower, having failed to repay the amount, notice is hereby given to the borrower, in particula and the public, in general, that the undersigned has taken possession of the property describe herein below in exercise of powers conferred on him under section 13(4) of the said Act read with rule 8 of the said Rules

The borrower, in particular, and the public in general, are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Hero Housing Finance Limited, for an amount referred to below along with interest thereon and penal interest, charges, costs

The borrower's attention is invited to provisions of sub-section (8) of Section 13 of the Act, in respec

Loan Name of Obligor(s)/ Account Legal Heir(s)/Legal		Date of Demand Notice/Amount as	Date of Possession (Constructive/
No.	Representative(s)	per Demand Notice	Physical)
HHFVAD	Mr. VINAY KUMAR SUSHIL	30/05/2022,	30/05/2023
HOU1900	KUMAR ZA,	Rs. 19,93,332/- as on	(Symbolic)
0002431	Mrs. RANJANA VINAY JHA	date 21/05/2022	

Description of Secured Assets/Immovable Properties: All That piece and parcel of Residentia Flat Bearing No. E-403, Situated at 4th Floor in Tower Cork Wood (E), Area Admeasuring Carpe Area 57.69 Sq. Mtr. Super Built Area 92.90 Sq. Mtr., Constructed on Land Bearing Revenue Survey No. 583, Admeasuring area 1-44-68 Hec. Are. Sq. Mirs. In the sim of Village Gorwa, F1 Jalanand Township, Gorwa Refinery Road, Sub District Vadodara, Gujrat -390016. With common amenities

Sd/- Authorised Officer, For Hero Housing Finance Limite



Earning Per Equity Share

(A) Basi

B) Diluted

Ajwa Fun World & Resort Limited

CIN : L45201GJ1992PLC018294 Regd. Office : Ajwa-Nimeta Road, P.O.: Ajwa Compound-391510, Tal : Waghodia, Dist : Baroda. (Gujarat) STATEMENT OF AUDITED FINANCIAL RESULTS FOR THE

	QUARTER / YEAR ENDED 31-03-2023									
			(₹i	n Lakhs ex	ccept per s	hare data)				
		Qı	uarter End	ed	Year Ended	Year Ended				
SR NO	PARTICULARS	31.03.23 AUDITED	31.12.2022 AUDITED	31.03.22 AUDITED	31.03.23 AUDITED	31.03.22 AUDITED				
1	Revenue from operations									
1	a) Total Income from Operations (net)	76.47	111.03	21.65	274.37	55.32				
	b) Other income	2.03	0.96	1.77	50.21	0.83				
	Total Income (a+b)	78.50	111.99	23.42	324.58	56.15				
2	Expenses									
	a) Purchase of Stock-in-Trade	1.85	75.45	3.93	88.48	11.29				
	 b) Changes in Inventories of Finished Goods, 	0.00	0.00	0.00	0.00	(0.09)				
	Stock-in-Trade and work-in-progress					' '				
	c) Employee Benefit expenses	34.07	16.67	16.24	34.07	52.21				
	d) Finance Costs	2.98	1.96	2.32	9.64	6.37				
	e) Depreciation and amortization expenses	4.89	6.80	6.03	19.54	24.11				
	f) Other Expenses	29.45	17.97	20.44	146.67	79.09				
	Total Expenses (a+b+c+d+e+f)	73.24	118.85	48.96	298.40	172.98				
3	Profit /(Loss) before tax (1-2)	5.27	(6.86)	(25.54)	26.18	(116.83)				
4	Tax Expense									
	(A) Current Tax	0.00	0.00	0.00	0.00	0.00				
	(B) Deferred Tax	0.00	0.00	0.00	0.00	0.00				
	(C) Short excess provision	0.00	0.00	0.00	0.00	0.00				
	(D) MAT Credit entitlement	0.00	0.00	0.00	0.00	0.00				
	Total Tax (A+B)	0.00	0.00	0.00	0.00	0.00				
5	Profit/(Loss) for the period (3-4)	5.27	(6.86)	0.00	26.18	(116.83)				
6	Other Comprehensive Income for the period	0.00	0.00	0.00	0.00	0.00				
7	Total Comprehensive Income for the period	5.27	(6.86)	0.00	26.18	(116.83)				
8	Paid un Equity Share Capital (Rs. 10 per share)	1 630 NN	630 00	630 00	630 NN	630 00				

Balance	Sheet	as	at	31st	March,	2023	(Rs. in Lacs

0.08

(0.11)

(0.11) (0.40)

(0.40)

0.41

		(1101111 = 1100)
PARTICULARS	As at 31st March, 2023 Rs.	As at 31st March, 2022 Rs.
ASSETS		
(1) Non-current assets		
(a) Property, Plant and Equipment	274.37	293.53
(b) Financial assets		
i) Investment		
ii) Other Financial Assets		
(c) Other non-current assets	105.59	105.59
(2) Current Asset		
(a) Inventories	0.79	0.79
(b) Financial assets		
i) Trade receivables	3.07	12.40
ii) Cash and cash equivalents	15.08	4.77
iii) Bank Balances other than (ii) above	5.53	62.38
(c) Other current assets	170.06	171.80
Total Assets	574.49	651.26
EQUITY AND LIABILITIES		
EQUITY		
(a) Equity share capital	639.00	639.00
(b) Other equity	(869.00)	(895.00)
LIABILITIES		
(1) Non Current Liabilities		
(a) Deferred Tax Liability (Net)		
(b) Financial Liabilities		
(i) Borrowing	358.98	858.67
(2) Current liabilities		
(a) Financial liabilities		
(i) Borrowing		
(iii) Trade payables	156.03	0.50
(b) Other current liabilities		
(c) Provisions	289.48	48.09
Total Equity and Liablities	574.49	651.26
	•	•

See notes accompanying to the Financial statements

NOTE: (1) The aforesaid financial results have been reviewed and recommended by Audit Committee and approved by the Board of Directors at their meeting held on 29th May, 2023. (2) The Statutory Auditors of the Company have carried out a "Limited Review" of the above results as per regulations 33 of SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015. (3) The Company has adopted Indian Accounting Standards (Ind AS) from 1st April, 2017. The Figures for the Quarter / Year ended 31st March, 2023 are in compliance with the Indian Accounting Standards (Ind AS) notified by the Ministry of Corporate Affairs. The figures for quarter ended 31s March, 2023 are the balancing figures between the audited figures in respect of the (Ind AS) notified by the Ministry of Corporate Affairs. The figures for quarter ended 31s March, 2023 are the balancing figures between the audited figures in respect of the full financial year and the year-to-date figures upto the third quarter of the financial year.

(4) The Financial results have been prepared in accordance with the recognition and measurement principles laid down in Indian According Standard 34 - Interim Financial reporting, notified under section 133 of the Companies Act, 2013 read with Companies (Indian According Standards) Rules, 2015, as amended from time to time, and other accounting principles generally accepted in India. (5) The format for above results as prescribed in SEBI's circular CIR/CPD/CMD/15/2015 dated Nov 30, 2015 has been modified to comply with the requirements of SEBI's circular dated July 5, 2016, Ind AS and Schedule III [Division II] to the Companies Act, 2013 applicable to companies that are required to comply with Ind As. (6) The Company has only one reportable primary business segment as per IND AS 108 i.e. Trading of Metals. (7) Effective from 1 April 2018, the company has adopted Ind AS 115 "Revenue from contracts with customers". The adoption of the standard did not have any material impact on the financial results of the company. (8) Figures for the previous period have been regrouped, reclassified and restated wherever necessary to make them comparable with the current periods figures.

Place · Vadodara

vith the current periods figures.

Place: Ahmedabad

Date: 30.05.2023

By order of Board of Directors For, AJWA FUNWORLD AND RESORT LTD, (Rajesh C. Jain) Managing Director DIN: 00006358

RIDDHI CORPORATE SERVICES LIMITED

CIN: L74140GJ2010PLC062548 Regd. Office: 10, Mill Officers Colony, Behind Old RBI, Ashram Road, Ahmedabad - 380009.
Phone: (079) 26580767 Web: www.riddhicorporate.co.in E-Mail: Investor@rcspl.net EXTRACT OF STANDALONE AUDITED FINANCIAL RESULTS FOR
THE YEAR ENDED ON 31TH MARCH, 2023 (Figures in Lakhs)

Sr. No	Particulars	Quarter ended on 31/03/2023 (Audited)	Quarter ended on 31/12/2022 (Unaudited)	Quarter ended on 31/03/2022 (Audited)	Year ended on 31/03/2023 (Audited)	Year ended on 31/03/2022 (Audited)
1	Total Income from Operations (Net)	5,162.53	5,693.64	3,868.66	20,154.55	11,629.22
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items#) Net Profit / (Loss) for the period before tax	340.97	338.34	203.75	1,106.65	784.08
٦	(after Exceptional and/or Extraordinary items#)	340.97	338.34	203.75	1,106.65	784.08
4	Net Profit / (Loss) for the period after tax				.,	
	(after Exceptional and/or Extraordinary items#)	248.13	258.00	173.68	842.00	584.43
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]					
6	Equity Share Capital	1186.70	1,137.50	1,137.50	1186.70	1,137.50
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	_		_		
8	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations)					
	- Basic	2.16	2.27	1.53	7.34	5.14
	- Diluted	2.16	2.27	1.53	7.34	5.14

Notes

The above results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors of the Company at their respective meetings held on May 30, 2023.

The above results for the quarter / year ended on March 31, 2023 have been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules, 2015 (Ind AS), prescribed under Section 133 of the Companies Act, 2013 and other recognised accounting practices and policies to the extent applicable.

The format of the above results as prescribed in SEBI's Circular CIR/CFD/CMD/15/2015 dated 30th November 2015 has been modified to comply with the requirements of SEBI's Circular dated 5th July, 2016, Ind AS and Schedule III [Division II] to the Companies Act 2013.

The Director reviews the operations of the Company as a whole, hence there are no reportable segments as pe Ind AS 108 "Operating Segments"

The Company has taken approval from the members of the company in the Extra-ordinary General Meeting of the Members of the company held on 20th March, 2023 for issue and allotment of 4.92,000 Equity Shares on Preferentia Basis to the holders prescribed in the notice their in and also 7,05,000 (Seven Lakhs Five Thousand) warrants each convertible into, or exchangeable for, 1 (one) fully paid-up equity share of the Company having face value of Rs.10/- (Rupee Ten Only) ("Equity Share") each ("Warrants") at a price (including the Warrant Subscription Price and the Warrant Exercise Price) of Rs.143/-.The Board of the directors in their meeting allot 492000 equity share on 24th January 2023 and warrants on 16th January 2023.

By Order - For, Riddhi Corporate Services Limited Place: Ahmedabad Mustafa Sibatra Date: 30/05/2023 Company Secretary & Compliance Officer

HINDUJA HOUSING FINANCE

Corporate Office: No. 27/A, Developed Industrial Estate, Guindy, Chennai, Tamilnadu-600032

Branch Office: 3rd, Floor, IFFCO Bhavan, B/h. Maruti Complex, 3/h. Pintoo Garment, Nr. Shivranjani Cross Road, Satellite, Ahmedabad-380015 Authorised Officer: Mr. Saurabhkumar Napit

E-mail: saurabhkumar@hindujahousingfinance.com PUBLIC AUCTION SALE NOTICE CUM TENDER FOR SALE OF SECURED ASSET UNDER RULE 8 (6) AND 9 (1)

Pursuant to possession taken hereunder by Authorized Officer of the below mentioned secured asset in exercise of the power conferred upon him under the provisions of Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 for the recovery of secured debts of Hinduja Housing Finance Ltd., for the outstanding amount mentioned here in below in Column No. C and furthe interest thereon along with cost and charges due from borrowers/co-borrowers. OFFERS are invited by the undersigned in sealed covers for purchase of immovable property, as described hereunder, which is in the physical possession, as on 'AS Is Where Is Basis', 'As Is What Is Basis' and 'Whatever Is There Is Basis as per the brief Particulars of which are given below:

- p						
Name of Borrower(s)/ Co-Borrower(s)/ Guarantor(s) (A)	Demand Notice Date & Amount Loan Account No & Branch (C)					
BORROWER: MR. PRAKASHBHAI SUDANI CO-BORROWER: MR.BHARAT SUDANI CO-BORROWER: MRS.MEGHNA SUDANI	Dt. 11-03-2022 & Rs.74,80,924/- & A/C No. GJ/AMD/GDDM/A000000007					
	D 111 # D1 111 400 0					

All that part and parcel of the property with al easement rights and pathway situated at Plot No. 107, Admeasuring 71 Sq. Meters along with 65 Sq. Meters Construction & 27.88 undivided share in the land of Road and COP in totally Admeasuring 98.88 Sq. Meters of 'Ganesh Row House situated at Block No. 42, TP Scheme No. 21, Fina Plot No. 84 of Moje Sarthana, Ta: Kamrej, District

SCHEDULE OF THE PROPERTY (B)

Surat. Bounded By: East: Plot No. 96 West: Road North: Plot No. 106 South: Plot No. 108

Reserve Price (RP) (D)	(EMD) (10% of RP) (E)	Date of Property Inspection and Time (F)	Auction Date & Time of opening Tenders (G)
Rs. 51,10,604/- (Fifty One Lacs Ten Thousand Six Hundred Four Only)	Rs. 5,11,060/- (Five Lack Eleven Thousand Sixty Only)	Date : 24-06-2023 Time : 12:00 PM to 04:00 PM.	Date : 04-07-2023 Time : 2:00 PM

AND WHEREAS the Authorized Officer of the Secured Creditor - Hinduja Housing Finance Limited ha decided to dispose off the said secured asset. This notice of sale is published today that the secured asset detailed above will be sold on 04-07-2023 at the above prescribed time and schedule at Hinduja Housing Finance Limited, Branch Office : 3rd, Floor, IFFCO Bhavan, B/h. Maruti Complex, B/h. Pintoo Garment Nr. Shivranjani Cross Road, Satellite, Ahmedabad-380015.

The Mortgagor /Notice in particular and the public in general is hereby cautioned and restrained not to dea with the Secured Assets in any manner in terms of Section 13(13) of the said Act and any dealing with the same will be subject to the charge of Hinduja Housing Finance Limited for the amounts and further interests thereon. The Mortgagors/ Noticee are given last chance to pay the total dues with further interest till 3rd July 2023 (date) before 5 PM (time) failing which, the secured asset will be sold as per schedule

The particulars in respect of the secured asset specified herein above in column No. (C) have been stated to the best of the information and knowledge of the undersigned, who shall however not be responsible for any error, misstatement or omission in the said particulars. The Tenderer(s) / Offerer(s) / Prospective Bidder(s) / Purchaser(s) are hereby notified that the secured asset will be sold with the Encumbrances and dues payable to Statutory Authority (if any) and are also requested, in their own interest, to satisfy himself / themselves/ itself with regard to the above and other relevant details pertaining to the above mentioned secured asset before submitting the tenders.

The Tenderer(s) / Offerer(s) / Prospective Bidder(s) / Purchaser(s) must submit their offer along with KYC and aforesaid Earnest Money Deposit (EMD) in a sealed envelope super scribed "offer for purchase of property", so as to reach the branch office at Hinduja Housing Finance Limited, 3rd, Floor, IFFCO Bhava B/h. Maruti Complex, B/h. Pintoo Garment, Nr. Shivraniani Cross Road, Satellite, Ahmedabad-380015 Branch (address) of which as mentioned above, on or before 04.07.2023, before 2 PM. EMD by way of DD / PO should be from a Nationalized /Scheduled Commercial Bank favouring " Hinduja Housing Finance Limited" payable at Chennai. For any further clarifications with regards to inspection, terms and condition: of the auction or submission of tenders, kindly contact Saurabh Kumar Napit Bid on Mobile No. 7874828789 8 Hitesh Kumar Patel : Mobile : 7878717172 The tenders which are acknowledged by the company official and registered before the cut off time with complete details shall only be considered for auction. The Authorise Officer reserves the right to reject any or all the bids without furnishing any reasons therefore.

The successful bidder should bear the charges/fee payable for conveyance such as registration fee, stamp duty etc., as applicable as per Law. The sale certificate shall be issued in the name of the purchaser/bidde and will not be issued in the any other name. The purchaser shall bear the stamp duty, registration charges and all other connected fees, duties, taxes etc. in relation to the execution of the sale certification

Successful bidder/purchaser will deduct TDS@1% on sale proceeds as per sec 194 (1-A) of the Income Tax, 1961 & deposit the same by furnishing the challan in Form 26QB and submit the original receipt of TDS

Certificate to Hinduja Housing Finance Ltd., (Rs.50.00 Lacs and above property)

The Authorised Officer reserves the right to reject any or all the bids without furnishing any reasons therefore Place : Surat **Authorized Officer**

Date: 01-06-2023 For, Hinduja Housing Finance Limited

WARDWIZARD FOODS AND BEVERAGES LIMITED

(Formerly known as Vegetable Products Lir

AHMEDABAD | THURSDAY, 1 JUNE 2023 Business Standard

CIN: L15100WB1953PLC021090 Regd. Off.: Old Nimta Road, Nandan Nagar, Belghoria, Kolkata-700083, WB Corporate Office: 418, GIDC Estate, POR, Ramangamdi, Vadodara - 391243 E-Mail: compliance@wardwizardfoods.com, Website: www.wardwizardfoods.com

Extract of Standalone Audited Financial Result for the quarter and year ended 31st March, 2023 🤻 in Lakhs) Ended 1 March No. Particulars Total Income from Operations

Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / 379.92 -197.69 780.89 -817.53 -15.54 -12.24 or Extraordinary items#) -617.57 -197.69 -15.54 -817.53 -20.18 Net Profit / (Loss) for the period before tax (after Exceptional and or Extraordinary items#)

Net Profit / (Loss) for the period defore tax (after Exceptional and / -693.58 -197.69 -15.54 -893.54 -20.18 or Extraordinary items#) Total Comprehensive Income for the period (Comprising profit/(loss) for the period (after tax) and other Comprehensive Income(after tax) Equity Share Capital Reserves (excluding Revaluation Reserve) as shown in the -693.58 -197.69 -15.54 -893.54 -20.18

1955.40

1582.40

092.00

-0.014 -0.014

2102.11

-0.670 -0.670

Diluted : (* Not annualised

Audited Balance Sheet of previous year) Earnings Per Share (for continuing and

discontinued operations) Basic : (* Not annualised

The Statement of Audited Financial Results for the Quarter and year ended 31st March, 2023 have been reviewed by the Audi Committee and approved by the Board of Directors at their meeting held on 30/05/2023.

These Audited Financial Results have been prepared in accordance with the Indian Accounting Standards (Ind-AS) as prescribed under Section 133 of the Company Act, 2013, read with the Companies (Indian Accounting Standards) Rules, 2015 as amended from time to time and the provisions of the Companies Act, 2013. The previous period figures have been regrouped/reclassified wherever required to confirm to the current year's presentation.

There are no qualification in the Audit Report issued by the Auditor.

- The figures for the current Quarter Ended March 31, 2023 and Quarter Ended March 31, 2022 are the balancing figures between the audited figures for the year ended March 31, 2023 and March 31, 2022, respectively and published figures for the nine months ended December 31, 2022 and December 31, 2021, respectively, which were subjected to limited review.
- Additions in PPE is ₹524.07 Lakhs and in Intangible Assets of ₹2190.64 Lakhs during the Financial Year 2022-2023 due to expansion of business. During the year the Company has been operating in Single Segment namely manufacturing in food industries and its activities, as per the guiding principles given in IndAS-108 on Operating Segments'.

No Investors complaint remains pending at the quarter ended on 31st March, 2023. The Company had received the permission dated August 29, 2022 for issue and allotment of 16,99,40,000 number of warrants convertible into Equity Shares at a price of ₹5/- per warrant each convertible into or exchangeable for One (1) Equity Share of face value of Re.1/- each ("the Equity Shares") (Including Premium of ₹4/- each), out of which 8,63,40,000 were converted into Equity

Share during the period.

Particulars	Original Allocation	Funds Utilsed	Unutilsed as on 31.03.2023
Used as per the object of Working Capital Requirements, General Corporate Purpose, Marketing & Branding, Investment in Group Companies, Plant & Machinery.	74,24,50,000/-	52,63,60,415/-	21,60,89,585/-
10. The Company has acquired the businesses from existing entity "Venny Foods" and "S	oforo Industrios	Drivata Limitad'	having cimilar

The Company has acquired the businesses from existing entity "Yeppy Foods" and "Safpro Industries Private Limited" having similar line of business, the same is reflected in above results. In view of the same prior period results are not entirely comparable.

For and on behalf of the Board Wardwizard Foods and Beverages Limited (Formerly Known as Vegetable Products Limited) Sd/- Sheetal Mandar Bhalerad Managing Directo DIN: 06453413

Place : Vadodara Date: 31.05.2023

Rajkot Nagarik Sahakari Bank Ltd. (Multistate Scheduled Bank)

Notice for Sale R.O. & H.O.: "Arvindbhai Maniar Nagarik Sevalay", 150' Ring Road, Nr. Raiya Circle, Rajkot. Ph. 2555716

1092.00 4332.45

-0.018 -0.018

In terms of the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest (SARFAESI Act-2002) Pursuant to the possession of the property described herein below is taken by the Authorized Officer on 12/02/2023 under SARFAESI Act.2002 for recovery of the secured debts of Rajkot Nagarik Sahakari Bank Ltd., from M/s. Ray Fashion Limited. OFFERS are invited by the undersigned in sealed cover for purchase of this property within 30 days from the date of this Notice, brief particulars of which is given hereunder on "AS IS WHERE IS BASIS" and "AS IS WHAT IS BASIS". For inspection of the property and tender form, one can contact us at Raikot Nagarik Sahakari Bank Ltd., Arvindbhai Maniar Nagarik Sevalay, Recovery Department, Head Office, 150 Feet Ring Road, Near Raiya Circle, Rajkot Or Our Ahmedabad Branch (Branch Address:- Mithakali Six Road, Navarangpura, Ahmedabad).

-> Date fixed for inspection of the property: 16.06.2023 (11:00 AM To 04:00 P.M.)

-> Last Date for submission of tender: 07.07.2023(Up To 04:00 P.M.)

-> Date, Time & Place of Opening the tenders: 10.07.2023, 11:00 A.M., at 'Arvindbhai Maniar Nagarik Sevalay',150" Ring Road, Nr. Raiya Circle, Rajkot.

Total

Dues	Price	of Deposit
Rs. 5,48,780=50 + Unapplied Interest w.e.f. 01/04/2015 + Legal Expense	Rs. 2,65,25,700/-	Rs. 26,52,600/-
	Dues Rs. 5,48,780=50 + Unapplied Interest w.e.f. 01/04/2015 + Legal	Dues Price Rs. 5,48,780=50 + Unapplied Interest w.e.f. 01/04/2015 + Legal Price Rs. 2,65,25,700/-

Terms & Conditions: 1. The immovable property is to be sold on 'As is where is' and 'As is what is' basis. 2. The purchaser will have to pay any type of Govt. dues / Semi. Govt. dues / Municipal taxes / Electricity Bills etc., if any, due on this property. If any document relating to this property is pending for payment of stamp duty, the purchaser will have to pay the same. 3. In the court cases, if any, relating to this Property, the orders of the court, would be binding to the purchaser, 4. The tenderer can bid for any amount, but he is to submit a Banker's Cheque/Demand draft of 10% of Reserve Price as deposit, as mentioned above payable to Rajkot Nagarik Sahakari Bank Ltd., Rajkot with the tender. 5. One can get tender form from the undersigned or from Ahmedabad branch. 6. The Bank reserves its right to accept or reject any tender. Property may not be sold below reserve price, 7. The tenderer will be required to pay 25% of the bid price on acceptance of his tender (10% of the reserve price submitted with the tender will be taken into account) 8. if the successful tenderer will fail to pay the accepted bid price, the amount of deposit will be forfeited by the Bank. 9. On unacceptance of the tender the amount of deposit will be refunded without any interest thereon. 10. The authorized officer does hereby state that, the bank is not aware about any charge or tax or liability for the said property. However, the bidder shall ensure by his own sources to find out any charges, lien, encumbrance, property tax, Government dues in respect of the property and the same shall be the responsibility of the tenderers.

*30 days Statutory Sale notice to the Borrower, Guarantors & Mortgagor.

*Prospective buyer may also visit our website www.rnsbindia.com for sale advertisement Dt. 31/05/2023

Authorized Officer. Rajkot Nagarik Sahakari Bank Ltd., H.O., Recovery Dept., Rajkot. Rajkot.

SANRHEA

SANRHEA TECHNICAL TEXTILES LIMITED

CIN: L17110GJ1983PLC006309

Regd Office: Parshwanath Chambers, 2nd Floor, Nr. New RBI, Income Tax, Ahmedabad - 380 014. Phone: (02764) 225204 E-mail: sanrhea@gmail.com Website: www.sanrhea.com

Extract of Audited Financial Results for the Quarter and Year ended on 31st March, 2023

				(Rs. In Lakhs)
		Year Ended		
Sr. No.	Particulars	31.03.2023 Unaudited	31.03.2022 Unaudited	31.03.2023 Audited
1	Total Income from operations	1541.11	1768.58	6280.35
2	Net Profit / (Loss) for the period (before Tax,			
	Exceptional and/or Extraordinary items)	113.48	263.01	343.59
3	Net Profit / (Loss) for the period before tax (after			
	Exceptional and/or Extraordinary items)	113.48	263.01	343.59
4	Net Profit / (Loss) for the period after tax (after			
	Exceptional and/or Extraordinary items)	82.21	190.19	254.09
5	Total Comprehensive Income for the period			
	[Comprising Profit / (Loss) for the period (after tax)			
	and Other Comprehensive Income (after tax)]	80.91	187.41	251.23
6	Equity Share Capital	500.00	430.00	500.00
7	Reserves (excluding Revaluation Reserve) as shown			
	in the Audited Balance Sheet of the previous year	-	-	-
8	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing			
	and discontinued operations)			
	(a) Basic	1.86	4.76	5.87
	(b) Diluted	1.69	4.44	5.24

Notes: The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the Stock Exchange website www.bseindia.com and on Company's website www.sanrhea.com

For SANRHEA TECHNICAL TEXTILES LIMITED

Tushar Patel (Managing Director) DIN: 00031632



Zonal Office: GANDHINAGAR ZONE, Unit No.4, Tower No.1, GIFT CITY, Gandhinagar -382355. Phone: 079 6674206-09 | Email: zo.gandhinagar@psb.co.in

PUBLIC NOTICE FOR E-AUCTION FOR SALE OF IMMOVABLE PROPERTIES LAST DATE & TIME OF SUBMISSION OF EMD AND DOCUMENTS (ONLINE) ON OR BEFORE IS 14-06-2023, 04:00 PM

Sale of Immovable properties mortgaged to Bank under Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002(No.54 of 2002)

Whereas the Authorized Officer of Punjab & Sind Bank had taken the possession of the following properties pursuant to the notice issued under Sec 13(2) of the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 in the following loan accounts with right to sell the same on "AS IS WHERE IS BASIS and AS IS WHAT IS BASIS" for realization of Bank's dues plus interest and whereas consequent upon failure to repay the dues, the undersigned in exercise of power conferred under Section13(4) of the said Act proposes to realize the Bank's dues by sale of the said Properties. The sale will be done by the undersigned through e-auction platform provided at the website https://www.bankeauctions.com.

	DESCRIPTION OF IMMOVABLE PROPERTIES													
Lot No.	Name of the Borrower(s) /Branch	Description of Properties	Type of Posseission	Reserve Price EMD Bid Increase Amount	Name of Authorised Officer	Property Inspection Date & Time	Date/ Time of e-Auction	EMD Submission Accounts Detail (Through NEFT/RTGS)						
1		Residential Flat No-204 Mahek Apartment sheri no 2, street	Physical	750000	Sh.Anant Kumar	12-06-2023	17-06-2023	04111100101221						
		No 2 Patel Patel Colony Jamnagar District — JAMNAGAR - 361008.		75000 10000	Mob: 9041031214	Mob: 9041031214	Mob: 9041031214	Mob: 9041031214	Mob: 9041031214	Mob: 9041031214	Mob: 9041031214	12 pm to 4 pm	12 pm to 4 pm	PSIB0000411
2		Plot no 8, "Pradeep", Ajaywadi, Nr. Kansara Kantha, B/h.	Symbolic	4859690	Sh Kamlesh Chichghare	12-06-2023	17-06-2023	04051100004215						
		Tilaknagar, Vadva RS no. 105 Paiky, CTS Ward no 5, CTS no 5515, Sheet no 178, Bhavnagar		485969 10000	Mob no 7982743932	12 pm to 4 pm	12 pm to 4 pm	PSIB0000405						
TE	DMO 0 CONDITIONS													

TERMS & CONDITIONS:

Place : Gujarat

.The E-Auction is being held on "AS IS WHERE IS" and "AS IS WHAT IS BASIS".

2. To the best of knowledge and information of the Authorized Officer, there is no encumbrance on any property/properties. However, the intending bidders should make their own independent inquiries regarding the encumbrances, title of property/properties put on auction and claims/ rights/ dues/ effecting the property/properties, prior to submitting their bid. The e-Auction advertisement does not constitute and will not be deemed to constitute any commitment or any representation of the bank. The property/properties is being sold with all the existing and future encumbrances whether known or unknown to the bank. The Authorized Officer/ Secured Creditor shall not be responsible in any way for any third party claims/ rights/ dues.

3.The intended bidders who have deposited the EMD and require assistance in creating Login ID & Password, uploading data, submitting bid, training on e-bidding process etc. may contact 3I Asset Resolution Consultant, arc31@yahoo.co.in, Contact person Mr. Chetan Bhardwaj Mob no +91 9825098339, chetan@3iarc.com, Mr. Tejas Patel. Mobile no +91 7779030614 the tejas71@gamil.com and C1 India Mr. Bhavik, Mob 8866682937, e-mail ID: support@bankeauctions.com and for any property related query may contact Authorized Officer as facilitation Centre to help the intending bidders.

4.The successful bidder shall have to deposit 25% of the sale price immediately on acceptance of bid price by the Authorized Officer and the balance of the sale price on or before 15th day of sale or within such extended period as agreed upon in writing and solely at the discretion of the Authorized Officer. (Office hours during the working days).

FOR DETAILED TERM AND CONDITIONS PLEASE REFER TO https://www.bankeauctions.com & https://punjabandsindbank.co.in This Notice is also to be treated as 15 days Statutory sale notice to the borrower and the Guarantor Under Rule 8(6) Security Interest (Enforcement), Rules 2002

Date: 01-06-2023

Authorized Officer PUNJAB & SIND BANK

હિરો ઈલેક્ટ્રીક, ઓલા, ઓકીનાવા અને ગ્રીવ્સ કોટનએ હેરાફેરી કરી

સખસીડી ગોટાળોઃ ઇ-સ્કુટર કંપનીઓ પાસેથી જંગી રકમ વસુલવા

વિદેશથી ઈલેક્ટ્રીક મોટર કંટ્રોલર અને ઓન ખોર્ડ ચાર્જર આયાત કરીને તેને દેશી સ્કુટરના ઉત્પાદનોમાં સ્વદેશી ઉત્પાદન તરીકે ખપાવી દીધાઃ સરકારે ઉપયોગ કરવાનો હતો પરંતુ તેઓએ રૂા.૧૪૦૦ કરોડની સબસીડી રોકી

અને બાઈક પરની સબસીડીમાં કેન્દ્ર હતી તે કારણ હોવાનું બહાર આવ્યું સરકારે કાપ મુકીને આ વાહનોને મોંઘા છે. સરકારે અગાઉ પણ ઈ–સ્કુટર સ્થપાવા કોશીશ કરી હતી જેમાં હવે

પાટનગરના શરાબ પોલીસી કાંડમાં

એક વ્યાપારી અમિત અરોરાને ફાયદો

કરાવવા માટે મનીષ સીસોદીયાએ રૂા.

ર.ર કરોડની લાંચ લીધી હોવાનો દાવો

એન્ફોર્સમેન્ટ વિભાગે ચાર્જશીટમાં

કર્યો છે. હાલ સીસોદીયા લાંબા

સમયથી જેલમાં છે અને હાઇકોર્ટ

સુધી તેના જામીન નકારાયા છે હવે

અદાલતમાં સનાવણી શરૂ થશે જેમાં

જણાવાયું છે કે સીસોદીયાના નજીક

મહારાષ્ટ્રમાં ખેડૂતો

માત્ર એક રૂપિયામાં

પાક વીમો લઈ શકશે

ખેડુતો માટે મંગળવારે મહત્વની

જાહેરાત કરી છે. નમો શેતકરી

મહાસન્માન નિધિ યોજનાને

કેબિનેટની બેઠકમાં લીલી ઝંડી

બતાવવામાં આવી છે. મહારાષ્ટ્રના ખેડૂતો હવે પાક વીમો ૧ રૂપિયામાં લઈ શકશે.

પ્રીમિયમ નહીં ચૂકવવું પડે કારણકે

તેમના ભાગનું ૨ ટકા પ્રીમિયમ રાજ્ય સરકાર ચૂકવી દેશે. માર્ચ

મહિનામાં રાજ્યના બજેટ વખતે

આ પ્રસ્તાવ મુકવામાં આવ્યો

હતો, જેને મંગળવારે યોજાયેલી

કેબિનેટ બેઠકમાં મંજૂરી આપવામાં

આવી હતી. વીમા કંપનીઓના

નફાને નિયંત્રિત કરતાં મોડલને પણ કેબિનેટે મંજૂરી આપી છે.

કેરળ હાઈકોર્ટનો ચુકાદો

એજ્યુકેશન લોન માટે

સિબિલ ઓછો હોય

છતાં ના ન પાડી શકાય થિરુવનંતપુરમ, તા.૩૧ કેરળ હાઈકોર્ટે તેની એક કેસ પર સુનાવણી કરતાં કહ્યું કે સિબિલસ્કોર ઓછો હોય તેમ છતાં કોઈ વિદ્યાર્થીને એજ્યુકેશન લોન

આપવા માટે બેક્ર ના ન પાડી શકે.

બેક્રોને ફટકાર લગાવતા જસ્ટિસ પી.વી. કુન્હીકૃષ્ણને શિક્ષણ લોન માટેની અરજી પર વિચાર કરતી

વખતે બેક્રોને માનવીય દષ્ટિકોણ અપનાવવા આગ્રહ કર્યો હતો.

એક અહેવાલ અનુસાર હાઈકોર્ટે

વિદ્યાર્થીની અરજી પર સુનાવણી કરતાં કહ્યું કે વિદ્યાર્થી ભવિષ્યના

રાષ્ટ્રનિર્માતા છે. તેમણે ભવિષ્યમાં દેશનું નેતૃત્વ કરવાનું છે. ફક્ત

એટલા માટે કે એક વિદ્યાર્થીનો

સિબિલસ્કોર ઓછો છે અને તેણે

એજ્યુકેશન લોન માટે અરજી કરી

છે, મારું માનવું છે કે આવા

વિદ્યાર્થીઓની એજ્યુકેશન લોન

અરજીને બેન્ક દ્વારા નંકારવામાં ન

આવે. આ મામલે અરજદાર જે

એક વિદ્યાર્થી છે તેણે બે લોન લીધી

હતી જેમાં એક લોનના ૧૬૬૬૭

રૂ. ચૂકવવાના બાકી હતા. બેક્રે બીજી લોનને એનપીએ કરી દીધી

હતી. આ કારણે અરજદારનો

સિબિલસ્કોર નબળો પડી ગયો

હતો. અરજદારના વકીલોએ

કોર્ટમાં કહ્યું કે જો તેને લોન નહીં

મળે તો તે મોટી મુશ્કેલીમાં ફસાઈ

જશે. અરજદાર વકીલે જણાવ્યું

હતું કે તેમના અસીલને એક મલ્ટી

નેશનલ કંપનીથી નોકરીની ઓફર

મળી છે અને તે થોડા સમય બાદ

સંપૂર્ણ લોન ચૂકવવામાં સક્ષમ

બની જશે. ત્યારબાદ હાઈકોર્ટે

બંને પક્ષોની દલીલો સાંભળ્યા

બાદ નિર્ણય અરજદારની

તરફેશમાં આપ્યો.

ખેડૂતોએ પાક વીમાનું

મુંબઈ, તા.૩૧

મહારાષ્ટ્ર સરકારે રાજ્યના

બનાવ્યા છે પરંતુ તેમાં ઈ-સ્કુટર કંપનીઓની રૂા.૧૪૦૦ કરોડની કેન્દ્ર સરકારે ઓકીનાવા ઓટોટેક

મનીષ સીસોદીયાએ રૂા.ર.ર કરોડની

લાંચ લીધી હતી : ચાર્જશીટમાં દાવો

દિલ્હીના પૂર્વ ઉપપ્રમુખ મંત્રી મનીષ મોટા વ્યાપારી અમિત અરોરાએ સોદો સૌની નજર છે. ઇડીએ ચાર્જશીટની

સીસોદીયાની મૃશ્કેલી વધી રહી છે કર્યો હતો અને તેમાં સીસોદીયાએ સાથે અમિત અરોરાની કંપનીના

આજ્યી સીસોદીયા સામે

ટ્રાયલ કોર્ટમાં સુનાવણીઃ

'આપ'ના નેતા પાસેથી કોઇ

રીકવરી થઇ નથી

તા.૧ જુનથી આ ચાર્જશીટ ઉપર ટ્રાયલ કોર્ટ કઇ રીતે સીસોદીયા નથી.

રૂા.ર.ર કરોડની લાંચ અપાઇ હતી. આ રકમ બાદમાં ચૂકવણી થઇ હતી.

જોકે હજુ સુધી ઇડીએ કોઇ નાણાકીય જોકે તેમાં રકમ કઇ રીતે અપાઇ અને

ગ્રીવ્સ સ્કોટનના નામ બહાર આવ્યા છે. આ કંપનીઓએ તેમના ઈ-ટેકનોલોજી અને સ્પેરપાર્ટસનો ઈલેકટીક મોટર કન્ટોલર અને ઓનબોર્ડ ચાર્જર વિદેશથી આયાત કરોડની રીકવરીની નોટીસ ફટકારી જે રીતે સરકાર સાથે છેતરપીંડી કરીને તેને સ્થાનિક ઉત્પાદક તરીકે

આવતીકાલથી ઈલેક્ટ્રીક સ્કુટર સબસીડી મેળવવા જે હેરાફેરી કરાતી ઈલેક્ટ્રીક, ઓકીનાવા, ઓલા તથા ઈલેક્ટ્રીક પાસેથી રૂા.૧૩૩ કરોડ, ફિપોર્ટમાં જણાવાયું છે કે કંપનીઓએ આવી છે. ઓલા ઈલેકટ્રીક પાસેથી રૂા.૧૩૦

કંપનીઓએ કરેલા ગોટાળાથી ગ્રાહકોને ડામઃ સરકારે સબસીડી ઘટાડતા હવે ઈ-વાહનો આજ્યી મોંઘા બનશે

છે અને ઓલાએ પોતાની 'ભુલ' સ્વીકારીને આ રકમ પરત આપવા તૈયારી બતાવી છે. ઓટોમોટીવ

હરિયાણામાં ઉભેલા ટ્રક્ની પાછળ કુઝર અને બાઇક ઘુસી જતા પાંચના મોત

હાંસી (હરિયાણા), તા. ૩૧ અત્રે નેશનલ હાઇવે-૯ પર હાંસીના રામપુરા ગામ પાસે આજે સવારે હોટેલ સાંઝા ચુલ્હા પાસે ઉભેલા એક ટ્રકની પાછળ ક્રુઝર અને બાઇક ઘસી જતા પાંચ લોકોના ઘટના સ્થળે મોત થયા છે. મૃતકોમાં એક મહિલા પણ સામેલ છે. મૃતકો રોહતક જિલ્લાના ગામ ખરકડાના જણાવાઇ રહ્યા છે.

આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ એક કંપનીની ક્રુઝર ગાડી કંપનીમાં કામ કરતા શ્રમિકોને લઇને જઇ રહી હતી ઓવર સ્પીડ અને વરસાદના કારણે આ ગાડીઓ રસ્તાના કિનારે રીકવરી કરી નથી. પરંતુ હવે દિલ્હીની કયાં જમા થઇ તે દર્શાવવામાં આવ્યું ઉભેલા એક ટ્રક સાથે ટકરાઇને ઘુસી ગઇ હતી.

કરવાનો પ્રયત્ન કર્યો તેની કિંમત હવે ગ્રાહકોએ ચૂકવવી પડશે. કેન્દ્ર સરકારે ફાસ્ટર એડપ્શન એન્ડ મેન્યુફેકચરીંગ ઓફ ઈલેકટ્રીક (ફ્રેમ) યોજના હેઠળ ઈ-વાહનો બનાવતી કંપનીઓને સબસીડીની જાહેરાત કરી હતી પરંતુ તેમાં દ્રીચક્રી વાહનોની કિંમત વધ્ને વધુ રૂા.૧.૫૦ લાખ રાખવા તેમજ લીથીયમ આયર્ન બેટરીનો ઉપયોગ કરવા અને ૫૦ ટકા સ્પેરપાર્ટસ

ચેક ગુમ થયેલ છે

સ્વદેશી હોય તે શરત રાખી હતી

પરંતુ કંપનીઓએ તેમાં ગેરરીતિ

હેલી માર્કેટીંગ ના પ્રોપરાઈટર હિમાંશુ ભટ્ટ તરફથી જાણ કરવામાં આવે છે કે અમારા સારંગપુર કો. ઓપરેટિવ બેન્ક, ગાંધીરોડ બ્રાન્ચ ના એકાઉન્ટ નં. 3275 ના અમુક સહી કરેલા ચેક ગુમ થઈ ગયા છે. ચેક નં. 508431, 508432, અને 508445 આ સિવાય પણ 2 ચેક જેના નં. ખ્યાલ માં નથી તે આ જાહેર ખબર પછી ભરાય તો ગેરકાનુની ગણવા.

નવી દિલ્હી તા.૩૧ ઉત્પાદક કંપનીઓ દ્વારા સરકારી સબસીડી રોકી છે જેમાં હીરો પાસેથી રૂા.૧૧૬ કરોડ, હીરો રીસર્ચ એસો. ઓફ ઈન્ડીયાના અને રીકવરી નોટીસ આપવામાં

PUBLIC NOTICE - PIDILITE INDUSTRIES LIMITED Regd. Office: 7th Floor, Regent Chambers, Jamnalal Bajaj Marg, 208 Nariman Point, Mumbai 400021.

NOTICE is hereby given that the certificate for the under mentioned securities of the Company has been lost/misplaced and the holder of the said securities/applicant has applied to the Company to issue duplicate certificate. Any person who has a claim in respect of the said securities should lodge such claim with the Company at its Registered Office within 15 days from this date, else the Company will proceed to ssue duplicate certificate without further intimation.

	Kind of Securities	Face Value	No. of Securities	Folio No.	Share Certificate No.	Distinctive Number	
HARAD H GAJJAR	EQUITY SHARES	Rs.1/-	800	PIS 0000609	00201286	3980951 To 3981750	
lace : Ahmedabad. Date : 29-05-2023. SHARAD I							

RIDDHI CORPORATE SERVICES LIMITED

CIN: L74140GJ2010PLC062548
Regd. Office: 10, Mill Officers Colony, Behind Old RBI, Ashram Road, Ahmedabad - 380009 Phone: (079) 26580767 Web: www.riddhicorporate.co.in E-Mail: Investor@rcspl.net EXTRACT OF STANDALONE AUDITED FINANCIAL RESULTS FOR THE YEAR ENDED ON 31TH MARCH, 2023 (Figures in Lakhs)

Sr. No	Particulars	ended on 31/03/2023 (Audited)	ended on 31/12/2022 (Unaudited)	ended on 31/03/2022 (Audited)	ended on 31/03/2023 (Audited)	ended on 31/03/2022 (Audited)
1	Total Income from Operations (Net)	5,162.53	5,693.64	3,868.66	20,154.55	11,629.22
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items#)	340.97	338.34	203.75	1,106.65	784.08
	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items#)	340.97	338.34	203.75	1,106.65	784.08
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items#)	248.13	258.00	173.68	842.00	584.43
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	_	_	_	_	-
6	Equity Share Capital	1186.70	1,137.50	1,137.50	1186.70	1,137.50
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	_	_	_	_	_
8	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations)					
	- Basic	2.16	2.27	1.53	7.34	5.14
	- Diluted	2.16	2.27	1.53	7.34	5.14

1) The above results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors of the Company at their respective meetings held on May 30, 2023.

 The above results for the quarter / year ended on March 31, 2023 have been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules, 2015 (Ind AS), prescribed under Section 133 of the Companies Act, 2013 and other recognised accounting practices and policies to the extent applicable.

3) The format of the above results as prescribed in SEBI's Circular CIR/CFD/CMD/15/2015 dated 30th November 2015 has been modified to comply with the requirements of SEBI's Circular dated 5th July, 2016, Ind AS and Schedule III [Division II] to the Companies Act 2013.

The Director reviews the operations of the Company as a whole, hence there are no reportable segments as per Ind AS 108 "Operating Segments".

 The Company has taken approval from the members of the company in the Extra-ordinary General Meeting of the Members of the company held on 20th March, 2023 for issue and allotment of 4,92,000 Equity Shares on Preferentia Basis to the holders prescribed in the notice their in and also 7,05,000 (Seven Lakhs Five Thousand) warrants, each convertible into, or exchangeable for, 1 (one) fully paid-up equity share of the Company having face value of Rs.10/- (Rupee Ten Only) ("Equity Share") each ("Warrants") at a price (including the Warrant Subscription Price and the Warrant Exercise Price) of Rs.143/-.The Board of the directors in their meeting allot 492000 equity share on 24th January 2023 and warrants on 16th January 2023.

Place: Ahmedabad Date: 30/05/2023

By Order - For, Riddhi Corporate Services Limited Mustafa Sibatra Company Secretary & Compliance Officer

FRESHTROP FRUITS LIMITED

ખાતાની માહિતી મોકલી આપી છે

જેમાં કેસ વ્યવહાર દર્શાવાયા છે.

ઉપરાંત એ પણ દર્શાવાયું છે કે

સીસોદીયાને આપવા માટે મોટી રકમ

અનામત રાખવામાં આવી હતી અને

Reg Office: A 603, Shapath IV, S. G. Road, Ahmedabad - 380015 Tel: 079 40307050 | www.freshtrop.com | CIN: L15400GJ1992PLC018365

EXTRACT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER / YEAR ENDED 31ST MARCH, 2023 (Rs. in Lakhs) Year ended 31 March 2022 (Audited) (Audited) 24,726.79 17,868.82 7,745.75 3,397.21 6,506.67 959.63 293.61 455.03 1,096.91 1,032.07 1,032.07 687.75 207.95 310.04 846.35 735.63 (11.46)13.94 7.63 17.52

Capital Employed has not been identified with any of the reportable segments, as the assets used in the Company's business and the liabilities contracted are used inter changebly between segments.

1,068.80

NOTE: (1) The above results were reviewed by the audit Committee and were approved and taken on record by the Board of Directors in their meeting held on May 30, 2023 (2) Revenue From Operations includes Export Incentives. (3) The Company has identified following segments as reportable segment in accordance with Ind AS-108 issued by the ICAI. Segment wise details are given to the extent possible. a) Fresh Fruits b) Food Processing (4) Previous Year's figures have been regrouped, reclassified wherever considered necessary.

Date: 30-05-2023 Place: Ahmedabad For & on behalf of the Board of Directors Ashok Motiani | Managing Director

850.93

989.49

753.16

1,068.80

317.67

1,068.80

BHAGWATI AUTOCAST LIMITED (CIN: L27100GJ1981PLC004718)

676.29

989.49

Regd. Office: Survey No. 816, (New Survey No. 259), Village: Rajoda, Nr. Bavla, Dist. Ahmedabad - 382 220. Ph. +91 2714-232283 / 232983 / 232066, E-mail: cs@bhagwati.com

[Rs. in lakhs except EPS]

Sr.		Quarter	Ended	Year Ended	
No.	Particulars	31.03.2023 (Audited)	31.03.2022 (Audited)	31.03.2023 (Audited)	31.03.2022 (Audited)
1	Total Income from operations	3631.72	2332.48	15442.09	11226.60
2	Net Profit / (Loss) for the period (before tax and exceptional items)	316.47	31.80	1083.10	(133.64)
3	Net Profit / (Loss) for the period before tax (after exceptional items)	316.47	31.80	1083.10	(133.64)
4	Net Profit / (Loss) for the period after tax (after exceptional items)	223.22	23.65	772.09	(95.74)
5	Total comprehensive income for the period [comprising profit for the	00.00.00000			25 (5)
	period (after tax) and other comprehensive income (after tax)]	222.94	12.57	770.50	(97.49)
6	Equity share capital (Face value per share Rs. 10/- each)	288.07	288.07	288.07	288.07
7	Reserves excluding revaluation reserves	See Stores	100000000000000000000000000000000000000	3154.21	2412.52
8	Earnings per share (before and after extraordinary items)			**************************************	
	(of Rs. 10/- each) Basic & Diluted	7.75	0.82	26.80	(3.32)

[1] The above financial results have been reviewed by the Audit Committee and thereafter approved by the Board of Directors of the Company in their respective meetings held on May 30, 2023. The statutory Auditors of the company have carried out Audit of aforesaid results as pe

Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulation, 2015.

[2] The financial results for the quarter and Year ended March 31, 2023 have been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules, 2015 (Ind AS) prescribed under Section 133 of the Companies Act, 2013 and other recognised accounting

practices and policies to the extent applicable.

[3] The above is an extract of the detailed format of Financial Results for the Quarter and Year ended 31st March, 2023, filed with the Stock

Exchanges, under the Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results is available on the Stock Exchange website www.bseindia.com and on the Company's website www.bhagwati.com

For, Bhagwati Autocast Limited

Place: Ahmedabad

(Dr. P. N. Bhagwati) DIN: 00096799

BHAGWATI

ભગવતી ઓટોકાસ્ટ લિમિટેડ

(CIN: L27100GJ1981PLC004718) રજી. ઓફિસઃ સર્વે નંબર ૮૧૬, ગામઃ રજોડા, બાવળા નજીક, અમદાવાદ-૩૮૨૨૨૦, ગુજરાત, ભારત.

ફોનઃ +૯૧ ૨७૧૪ ૨૩૨૨૮૩/૨૩૨૯૮૩/૨૩૨૦૬૬ E-mail: cs@bhagwati.com Website: www.bhagwati.com શેરહોલ્ડરોને જાણ કરવા માટેની પોસ્ટલ બેલેટ નોટિસ અંગેની માહિતી

આથી નોટિસ આપવામાં આવે છે કે, કંપની અધિનિયમ, ૨૦૧૩ સેળી (લિસ્ટિંગ ઓળ્લીગેશન્સ અને ડિસક્લોઝર

રિક્વાયરમેન્ટસ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ (લિસ્ટિંગ રેગ્યુલેશન્સ) અને કોર્પોરેટ કાર્યાલય મંત્રાલયના તારીખ ૮ એપ્રિલ, ૨૦૨૦, ૧૩ એપ્રિલ, ૨૦૨૦, ૫ મે, ૨૦૨૦, ૧૫ જૂન ૨૦૨૦, ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૦, ૩૧ ડિસેમ્બર, ૨૦૨૦, ૨૩ જૂન, ૨૦૨૧, ૮ ડીસેમ્બર, ૨૦૨૧, ૫ મે, ૨૦૨૨ અને ૨૮ ડિંસેમ્બર, ૨૦૨૨ના રોજ જારી કરેલા પરિપત્રો (સામુહિક રીતેં એમસીએ પરિપત્રો) માં જણાવ્યા મુજબ, સ્વતંત્ર ડિરેક્ટર્સની પુન:નિયુક્તિ કરવા માટે ભગવતી ઓટોકાસ્ટ લિમિટેડ (કંપની)ના શેર હોલ્ડરોની મંજૂરી મેળવવા માટે પોસ્ટલ બેલેટ ખસેડવાનો દરખાસ્ત કરી રહી છે.

એમસીએના પરિપત્રોનું પાલન કરીને, સૂચક નિવદનો સાથે, સૂચક ઠરાવો અને મતદાન સૂચનાની પોસ્ટલ બેલેટની ઈલેક્ટ્રોનિક નકલ, બધા શેરહોલ્ડરોને મોકલવામાં આવશે, જેમના ઈ-મેઈલ સરનામાં કંપની/રજિસ્ટ્રાર અને શેર દ્રાન્સફર એજન્ટ (આરટીએ)/ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટસ (ડીપી) સાથે નોંધાયેલા છે. ઉપર જણાવેલ પોસ્ટલ બેલેટ नोटिस साथे तमाम જोडाएो, इंपनीनी वेजसार्धर www.bhagwati.com पर अने स्टोङ એક्सचेन्द्रनी वेजसार्धर www.bseindia.com પર અને ઈ–વોટિંગ એજન્સી, એન.એસ.ડી.એલની વેબસાઈટ www.evoting.nsdl.com પર પણ ઉપલબ્ધ કરવામાં આવશે

ઈ-મેઇલ આઇડીની નોંધણી કરવા માટેની પ્રક્રિયા નીચે મુજબ છે.

એ) જેમના શેર ફીઝીકલ સ્વરૂપે હોય અને જેમણે કંપની/આરટીએ સાથે તેમના ઈ-મેઈલ એડ્રેસની નોંધણી કરાવી નથી, તેવા શેર હોલ્ડર્સ કંપનીની વેબસાઈટ www.bhagwati.com પર મુકેલા ફોર્મ નંબર ISR-1, SH-13/ISR-3 આપીને અમારા રજીસ્ટ્રાર અને કંપનીના ટ્રાન્સફર એજન્ટ, એમસીએસ શેર ટ્રાન્સફર એજન્ટ લિમિટેડને ઈ-મેઈલ આઈડી mcsstaahmd@gmail.com પર સ્કેન કોપી અને ૧૦૧, પહેલા માળે, શતદલ કોમ્પલેક્ષ, બાટા શો-રુમની સામે, આશ્રમરોડ, અમદાવાદ – ૩૮૦૦૦૯, ગુજરાત પર મોકલીને નોમિનેશન સહિત કેવાયસી અપડેટ કરાવી શકે છે. બी) જેમના शेर्स डिमेट स्वरूपे होय, तेवा सभ्यो तेमना ઇ-मेઇલ आઇडीनी नोंधणी કरवा माटे तेमना डिपोफ्रिटरी

પાર્ટીસિપન્ટસ અને તેમની રીત પ્રમાણે કરી શકે છે. લાગુ પડતા કાયદા અનુસાર, પોસ્ટલ બેલેટની નોટિસ ફક્ત ઈલેક્ટ્રેનિક માધ્યમથી શેર હોલ્ડરોને મોકલવામાં આવશે. ભગવતી ઓટોકાસ્ટ લિમિટેડ વતી,

તારીખ: 39.04.૨0૨3 સ્થળઃ અમદાવાદ

સહ]/- મેહલ નલિયાધરા કંપની સેકેટરી અને કંપલાયન્સ ઓફિસર

APOLLO

GUJARAT APOLLO INDUSTRIES LTD. CIN No. L45202GJ1986PLC009042. Web: www.apollo.co.in Regd. Off: Block No. 486, 487, 488, Mouje Dholasan, Taluka & District: Mehsana-382732.

Corp. Off: "Parishram", 5-B, Rashmi Society, Nr. Mithakhali Six Road, Navrangpura, Ahmedabad-380009 EXTRACT OF THE STATEMENT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND FINANCIAL YEAR ENDED ON MARCH 31, 2023

60		Standalone			Consolidated			
Sr	Particulars	Querter Ended	100	Querter Ended	Year	Ended		
No	raruculars	31.03.2023	31.03.2023	31.03.2022	31.03.2023	31.03.2023	31.03.2022	
		Audited	Audited	Audited	Audited	Audited	Audited	
1	Total Income from operations	762.82	3,614.95	4,221.08	2,345.95	9,640.08	8,146.12	
2	Net Profit for the period (before exceptional items and Tax)	(102.66)	166.39	17.02	107.56	1,149.88	1,376.65	
3	Net Profit for the period before tax (after exceptional)	(102.66)	166.39	17.02	107.56	1,149.88	1,376.65	
4	Net Profit for the period after tax	(58.91)	201.08	87.53	489.02	1,247.19	818.01	
5	Total Comprehensive income for the period [Comprising profit for the	(58.91)	201.08	87.53	(622.06)	442.29	1,730.65	
	period (after tax) and other comprehensive income (after tax)				8 9		No.	
6	Paid-up equity share capital (face value of ₹ 10/- each)	1,180.00	1,180.00	1,180.00	1,180.00	1,180.00	1,180.00	
7	Other Equity (excluding revaluation reserve)	23	22,009.35	22,040.49	879	46,689.62	51,168.56	
8	Earnings per share (for continuing operations)							
	Basic (in ₹)	(0.50)	1.70	0.74	(0.56)	9.68	7.87	
	Diluted (in ₹)	(0.50)	1.70	0.74	(0.56)	9.68	7.82	
Dinute (in C)								

Note: The above is an extract of the detailed format of quarterly / yearly financial results filed with the stock exchange under regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015. The full format of the quarterly / yearly financial results is available on the company website at ww.apollo.co.in and on the BSE website at www.bseindia.com and NSE website at www.ns

For and on behalf of Board of Directors **GUJARAT APOLLO INDUSTRIES LIMITED** Asit A. Patel - Managing Director DIN: 00093332

ase[®] Ambalal Sarabhai Enterprises Limited[®]

Regd. Office: Shanti Sadan, Mirzapur Road, Ahmedabad - 380001

Phone: 079-25507671, 25507073 | Website: www.ase.life | E-mail: ase@sarabhai.co.in

EXTRACT OF AUDITED CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED 31ST MARCH, 2023

(₹ in Lakhs, except per share data)

Sr.		Quarte	r ended	Year ended		
No.		31.03.2023	31.03.2022	31.03.2023	31.03.2022	
		Audited	Audited	Audited	Audited	
1	Total Income from Operations (Including Other Income)	4880.01	6296.65	18277.28	23876.07	
2	Net Profit / (Loss) for the period (before tax and exceptional items)	693.21	881.40	1482.52	6930.61	
3	Net Profit / (Loss) for the period before tax and after exceptional items	693.21	881.40	1482.52	5419.35	
4	Net Profit / (Loss) for the period after tax and exceptional items	549.29	758.98	1110.10	4721.84	
5	Total Comprehensive Income for the period {Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)}	538.94	702.42	1071.21	4608.09	
6	Paid-up Equity Share Capital (Face Value ₹ 10/- Per Share)	7,663.33	7,663.33	7,663.33	7,663.33	
7	Other Equity as shown in the Audited Balance Sheet of the previous year	-	-	5428.98	4323.32	
8	Earnings Per Share (of ₹10/- each) Basic and Diluted Earning Per Share (Not Annualized) (in ₹)	0.72	0.99	1.45	6.16	

1. Key numbers of Standalone Results are as under

unaer:				(TIT Lakits)	
	Quarte	r ended	Year ended		
	31.03.2023	31.03.2022	31.03.2023	31.03.2022	
	Audited	Audited	Auditod	Audited	

Particular	31.03.2023	31.03.2022	31.03.2023	31.03.2022	
	Audited	Audited	Audited	Audited	
Total Income from Operations (Including Other Income)	371.53	689.71	1424.07	3966.29	
Net Profit / (Loss) before tax	122.92	(988.66)	433.67	345.21	
Net Profit / (Loss) after tax	111.65	(1041.77)	411.07	295.61	
	The second secon				

2. The above is an extract of the detailed format of the Financial Results for the Quarter and Financial Year ended March 31, 2023 filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Standalone and Consolidated Financial Results are available on the website of the Stock Exchange www.bseindia.com and the Company's Website www.ase.life respectively.

3. The above financial results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their meeting held

4. These results have been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules 2015 (Ind AS) prescribed under Section 133 of the Companies Act 2013 and other recognized accounting practices and policies to the extent applicable.

For, Ambalal Sarabhai Enterprises Limited Kartikeya V Sarabhai

Date: 30.05.2023 Place: Ahmedabad















